

आलेख [GRAPH]

अध्याय

07




परिचय (Introduction)

गणित में हम जानकारियों को, बेहतर समझ व विश्लेषण के लिए कई माध्यमों से निरूपित और प्रदर्शित करते हैं। ऐसा ही एक माध्यम आलेख है जिसकी सहायता से हम बता सकते हैं कि किसी एक राशि से दूसरी राशि का क्या संबंध है। आलेख के माध्यम से यह भी देखा जा सकता है कि परस्पर संबंधित दो राशियों में से किसी एक में परिवर्तन करने पर दूसरे में क्या बदलाव आता है। इनके साथ-साथ आलेख बनाने से कुछ नई जानकारियाँ भी पता की जा सकती हैं। इस अध्याय में हम आलेख के विभिन्न उपयोगों को देख सकेंगे।


दो राशियों के बीच के संबंध –

कुछ व्यक्ति कपड़े की एक दुकान से 25 रुपये प्रति मीटर की दर से 1 मीटर, 2 मीटर, 3 मीटर, 4 मीटर और 5 मीटर लंबाई के कपड़े क्रमशः 25रु., 50रु., 75रु., 100रु. और 125रु. में खरीदते हैं। उनके द्वारा चुकायी गई कीमतों और कपड़े की लंबाइयों के बीच के संबंध को आलेख में प्रदर्शित किया गया है। आलेख में हम यह देख पाते हैं कि कपड़े की लंबाई बढ़ने से चुकाई गई कीमत में किस तरह का परिवर्तन हो रहा है।

आइए एक और उदाहरण देखते हैं।



क्रिकेट के एक मैच में एक टीम के द्वारा शुरू के दस ओवरों में बनाए गए रनों की संख्या इस प्रकार थी— 5, 4, 8, 7, 2, 5, 4, 4, 2, 9. यदि हम ओवरों की संख्या और उनमें बने रनों की संख्या को लेते हुए आलेख खींचें तो चित्र 2 जैसा आलेख प्राप्त होगा। —



आलेख-02

सोचें व चर्चा करें

क्या आलेख में लिए गए आँकड़ों के बीच कोई संबंध है?

- एक प्रकार के आँकड़ों को X अक्ष पर और दूसरे प्रकार के आँकड़ों को Y अक्ष पर प्रदर्शित किया गया। क्या आँकड़ों के लिए अक्षों को चुने जाने का कोई आधार है?
- एक आलेख सरल रेखा के रूप में है, दूसरा टेढ़ी-मेढ़ी रेखाओं के रूप में, क्या इसका कोई कारण हो सकता है?

आलेख बनाना सीखें :-

आलेख बनाने के लिए हमें दो तरह के आँकड़ों की जरूरत होती है। हम एक को X अक्ष और दूसरे को Y अक्ष पर दर्शाते हैं। क्या इन आँकड़ों को हम किसी भी अक्ष पर दर्शा सकते हैं? अथवा किस आँकड़े को X अक्ष और किस को Y अक्ष पर दर्शाना है इसके लिए कुछ आधार होते हैं।

आलेख 1 में देखें तो पाएँगे कि अगर हम ज्यादा कपड़ा खरीदते हैं तो हमें कीमत भी अधिक देनी होती है। अगर कम कपड़ा खरीदते हैं तो कीमत कम होगी। यह एक उदाहरण है जहाँ एक राशि दूसरी राशि को प्रभावित करती है। चुकाई गई कीमत, कपड़े की मात्रा पर निर्भर करती है। इस तरह हम कह सकते हैं कि यहाँ कपड़े की मात्रा एक मुक्त या स्वतंत्र चर है जबकि

चुकाई गई कीमत एक आश्रित चर है। प्रायः हम स्वतंत्र चर (ऑकड़े) को X अक्ष पर तथा आश्रित चर को Y अक्ष पर दर्शाते हैं।

एक बार यह निश्चित हो जाए कि हमें X अक्ष पर कौन सा और Y अक्ष पर कौन सा ऑकड़ा लेना है, उसके बाद दोनों अक्षों के लिए पैमाना चुनते हैं।

पैमाना – X अक्ष और Y अक्ष पर वांछित राशियों को निरूपित करने के लिए पैमाने का चयन राशि अनुसार करना होता है। आइए इस प्रक्रिया को आलेख-1 से समझते हैं। 6 मी. कपड़े के लिए चुकाई गई कीमत 125 रु. है। यदि हम 1 बड़े वर्ग की लंबाई = 1 रुपया पैमाना चुनने का निश्चय करें, तो हमें 125 वर्ग का अक्ष खींचना होगा। जो कागज की शीट पर संभव नहीं। इसके विपरीत 1 बड़े वर्ग की लंबाई = 50 रु. का पैमाना चुने तो बहुत कम फैलाव होगा अतः हम ऐसा पैमाना चुनेंगे जिससे संबंध साफ दिखे। यहाँ हमने 1 बड़े वर्ग की लंबाई = 25 रु. ली और हमें 6 इकाई का अक्ष खींचना होगा। ग्राफ खींचने के लिए पैमाने का चयन करते समय कुछ बातों का ध्यान रखना होगा।

- प्रत्येक राशि के अधिकतम और न्यूनतम मानों के बीच अंतर
- जिस पेपर पर आलेख खींचना है, उसके अधिकतम भाग का उपयोग करना।

प्रत्येक बिंदु को आलेख पर चिह्नित करते हैं। X अक्ष पर इंगित राशि के मान के लिए Y अक्ष की राशि के मान अनुसार X अक्ष से दूरी पर बिंदु अंकित करते हैं। इन दोनों मानों से ही ग्राफ पर बिंदु बनता है।

सभी बिंदुओं को जोड़कर आलेख प्राप्त करते हैं।

आलेखों से हमें क्या पता चलता है?

आपने अखबारों, पत्रिकाओं और टेलीविजन कार्यक्रमों में अलग-अलग तरह के आलेख देखे होंगे। वास्तव में ये आलेख संख्याओं से बने ऑकड़ों के चित्रात्मक प्रदर्शन हैं। एक नजर डालने भर से हमें कई जानकारियाँ मिल जाती हैं। हम दोनों आलेखों को बारी-बारी से देखें तो पता चलेगा कि कपड़े की लंबाई और उसके मूल्यों को निर्देशांक मानकर खींचा सरल रेखा आलेख यह बताता है कि कपड़े के मूल्य और उसकी लंबाई के बीच एक निश्चित अनुपात है।

$$\left(\frac{100}{4}, \frac{75}{3}, \frac{25}{1} \dots \text{आदि} \right)$$

यदि हम यह जानना चाहें कि किसी दी गई लंबाई के कपड़े का मूल्य क्या होगा या दिए हुए रुपयों में कितना कपड़ा खरीदा जा सकेगा तो हम आलेख द्वारा इसे भी बहुत आसानी से जान सकते हैं।

इसी तरह दूसरा टेढ़ा-मेढ़ा आलेख यह बताता है कि किसी ओवर में कितने रन बनेंगे यह अनिश्चित है। लेकिन आलेख को देखकर यह तुरंत बताया जा सकता है कि किस ओवर में सबसे ज्यादा या सबसे कम रन बने। औसत रन संख्या जानकर यह भी बताया जा सकता है कि 20 या 50 ओवर की समाप्ति पर लगभग कितने रन बन सकते हैं। किंतु यह अनुमान गलत भी हो सकता है क्योंकि बाद के ओवरों में रन तेजी से भी बन सकते हैं या पूरी टीम आउट भी हो सकती है।

कुछ और आलेख -

आलेख 3 :- उच्चतर माध्यमिक शाला जमराँव के छात्रावास में किसी एक सप्ताह के अलग-अलग दिनों में छात्रों की संख्या और उनके लिए पकाई गई दाल की मात्रा के ऑकड़े निम्नानुसार थे -

छात्र संख्या	16	19	22	23	21	18	17
दाल की मात्रा (किग्रा. में)	1.280	1.520	1.760	1.840	1.680	1.440	1.360


ऑकड़े (छात्र संख्या, दाल की मात्रा) के रूप में हैं।

क्या छात्रों की संख्या और उनके लिए पकाई जाने वाली दाल की मात्रा में कोई संबंध है? आइए इसे आलेख बनाकर समझें।

आप देख रहे हैं कि दाल की मात्रा छात्रों की संख्या बढ़ने-घटने के साथ ज्यादा या कम हो रही है। क्या इस बदलाव की कोई निश्चित दर है?

आपस में चर्चा करें। इस आलेख में एक बात ध्यान देने की है। यहाँ ग्राफ 0,0 से शुरू

नहीं होता ऐसा कई आलेखों में होता है जहाँ कई बार ऑकड़े शून्य के नजदीक से शुरू नहीं होते। ऐसी स्थिति में हम आलेख पर \nearrow चिह्न के द्वारा खाली जगह को दर्शाते हैं। जैसे ऊपर दिए गए आलेख में X अक्ष पर ऑकड़े 16 से शुरू होते हैं और 1 से 16 के बीच कोई ऑकड़ा नहीं है। इसलिए X अक्ष पर मूल बिंदु शून्य से 16 के बीच के भाग को \nearrow चिह्न से दर्शाया गया है।



आलेख-03

सोचें एवं चर्चा करें

यदि दिन क्रमांक के साथ पकाई दाल की मात्रा अथवा उपरिथित बच्चों का आलेख बनाएँ तो वह कैसा होगा?


આલેખ 4 :- ફૂલમતી ને અપને ઘર કે લિએ 4 કિલોગ્રામ ચાવલ ખરીદા | ઉસકે યહું રોજ 500 ગ્રામ ચાવલ પકતા હૈ | ક્યા હમ પ્રત્યેક દિન બચે હુએ ચાવલ કા આલેખ બના સકતે હું ?

હલ :- ઇસ આલેખ કે આંકડે (દિન, બચે હુએ ચાવલ કી માત્રા) કે રૂપ મેં હું | પહુલા બિંદુ (1,3.5) ઔર પાંચવા બિંદુ (5,1.5) હૈ |

આપ દેખ રહે હું કે દિનોં કી સંખ્યા બઢને કે સાથ બચે હુએ ચાવલ કી માત્રા કમ હોતી જા રહી હૈ | ક્યા આપ આલેખ કો દેખકર બતા સકતે હું કે ચાવલ કબ ખત્મ હો જાએગા?

કરકે દેખો

1. અપને આસ-પાસ સે ઇસી પ્રકાર કે આંકડે ઇકટ્ટે કર ઇન આંકડોં સે આલેખ બનાઇએ |
2. આલેખ 3 ઔર 4 દોનોં એક સરલ રેખા હૈ કિંતુ દોનોં એક દૂસરે સે ભિન્ન હૈ | ઇન્મેં ક્યા-ક્યા ફર્ક હૈ ?
3. આલેખ 3 ઔર 4 મેં (x,y) કી તાલિકા બનાએ |



આલેખ-04

આલેખ 5 :- વર્ગો કી એક ભુજા કી માપ વ ઉન વર્ગો કે પરિમાપ કો સારણી મેં પ્રદર્શિત કિયા ગયા હૈ |


વર્ગ કી ભુજા કી માપ (સેમી. મે)	1	2	3	4	5	6	7
વર્ગ કા પરિમાપ (સેમી. મે)	4	8	12	16	20	24	28

સારણી કે આંકડોં સે આલેખ બનાઇએ તથા નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજિએ –

1. x અંકડોં સે આંકડા ચુનેં |
2. y અંકડોં સે આંકડા ચુનેં |

હલ :- ઇસ આલેખ મેં હમ દેખ પા રહે હું કે વર્ગ કી એક ભુજા કી માપ મેં વૃદ્ધિ હોને સે ઉસકે પરિમાપ મેં ભી વૃદ્ધિ હો રહી હૈ | ઊપર દિએ હુએ આંકડોં મેં વર્ગ કી ભુજા કી માપ એક સ્વતંત્ર ચર હૈ ઔર વર્ગ કા પરિમાપ આશ્રિત ચર હૈ | અત: x અંકડોં સે વર્ગ કી ભુજા કી માપ ઔર y અંકડોં સે વર્ગ કા પરિમાપ દર્શાએં |

આલેખ 6 :- કિસી વર્ગ કી એક ભુજા કી લંબાઈ મેં પરિવર્તન કરને પર પ્રાપ્ત હુએ ક્ષેત્રફળ કો નીચે સારણી મેં દર્શાયા ગયા હૈ | ઇનકી સહાયતા સે એક આલેખ બનાઇએ |




આલેખ-05

वर्ग की भुजा की माप (सेमी. में)	0	1	2	3	4	5	6	7
वर्ग का क्षेत्रफल (वर्गसेमी. में)	0	1	4	9	16	25	36	49

हलः— वर्ग की भुजा और उसके क्षेत्रफल के बीच खींचे गये आलेख को देखने पर यह पता चल रहा है कि भुजा की लंबाई बढ़ने पर क्षेत्रफल का मान भी बढ़ता है, किन्तु यहाँ सरल रेखा के स्थान पर ऊपर उठती हुई एक वक्र रेखा प्राप्त होती है।

सोचें व चर्चा करें

आलेख 5 व आलेख 6 में आपको क्या—क्या और अंतर दिख रहे हैं? चर्चा कीजिए।



आलेख-06


आलेख 7 :- मार्च महीने के किसी दिन

के सुबह 6 बजे से शाम 6 बजे तक का तापमान नीचे की सारणी में प्रदर्शित है—

समय बजे	पूर्वाहन							अपराह्न						
	6	7	8	9	10	11	12	1	2	3	4	5	6	
ताप (°C पर)	23	25	27.5	29	31	33.5	35.5	37.5	38.5	39	37.5	34	30	

सारणी के ऑकड़ों के आधार पर आलेख खींचिए।

हलः— यहाँ हम देख सकते हैं कि यह आलेख पहले खींचे गए आलेखों से अलग है। समय बढ़ने के साथ—साथ पहले तापमान बढ़ रहा है तथा एक समय के बाद कम भी हो रहा है।



आलेख-07

ક્યા આપ ઇસકા કારણ સોચ સકતે હૈન?

અપને સાથિયોં સે ઇસ પર ચર્ચા કીજિએ।

ઇસ આલેખ કે આધાર પર 5 નિષ્કર્ષ લિખોં।

આલેખ 8 :- મૂલધન 100 રૂપયે પર 10 પ્રતિશત વાર્ષિક બ્યાજ દર સે 1, 2, 3 વ 4 વર્ષ કે લિએ સાધારણ બ્યાજ જ્ઞાત કીજિએ। સમય વ સાધારણ બ્યાજ કે બીચ આલેખ બનાકર દેખિએ કિ સમય કે સાથ સાધારણ બ્યાજ મેં કિસ પ્રકાર પરિવર્તન હો રહા હૈ?

સાથ હી નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉત્તર દીજિએ।

1. x અક્ષ પર કૌન સા ઓંકડા ચુના।
2. y અક્ષ પર કૌન સા ઓંકડા ચુના।
3. x અક્ષ ઔર y અક્ષ પર ઓંકડે દર્શાને કે લિએ આપને ક્યા પૈમાના ચુના?

હલ:- હમેં દિયા હૈ -

$$\text{મૂલધન} = 100 \text{ રૂપયે, દર} = 10\%$$

$$\text{સાધારણ બ્યાજ} = \frac{\text{મૂલધન} \times \text{દર} \times \text{સમય}}{100}$$

મૂલધન વ દર કો સ્થિર રહ્યે હુએ સમય કા માન 1, 2, 3 વ 4 વર્ષ રહ્યાને પર પ્રાપ્ત હોને વાલે સાધારણ બ્યાજ કો નિમ્નાનુસાર સારણી મેં દર્શા સકતે હૈન-


સમય (વર્ષ મેં)	0	1	2	3	4
સાધારણ બ્યાજ (રૂપયે મેં)	0	10	20	30	40

ગ્રાફ સે હમ કહ સકતે હૈન કિ જબ મૂલધન વ દર સ્થિર હોય, તબ સમય બઢને કે સાથ સાધારણ બ્યાજ મેં ભી નિશ્ચિત દર સે પરિવર્તન હોતા હૈ।

x અક્ષ પર સમય (સ્વતંત્ર ચર) y અક્ષ પર સાધારણ બ્યાજ (આશ્રિત ચર) ચુના

$$\text{પૈમાના} - x \text{ અક્ષ પર } 1 \text{ ઇકાઈ} = 1 \text{ વર્ષ}$$

$$y \text{ અક્ષ પર } 1 \text{ ઇકાઈ} = 10 \text{ રૂ.}$$



આલેખ-08

करके देखें

- कुछ लोगों को क्रमशः 100रु., 200रु., 300रु., 400रु. 10% वार्षिक साधारण ब्याज की दर से उधार दिया गया। एक वर्ष बाद इनसे मिलने वाले ब्याज के लिए एक आलेख बनाइए।
- अपनी कक्षा के 10 विद्यार्थियों की आयु महीनों में एवं उँचाई सेमी. में नोट कीजिए और आयु तथा उँचाई के आकड़ों को आलेख में दर्शाइए। क्या आलेख में आयु व उँचाई के बीच कोई निश्चित संबंध देख पा रहे हैं ?

अब तक बने आलेखों में आपने देखा कि कुछ में सरल रेखा और कुछ में वक्र रेखा प्राप्त हो रही है। क्या आप बता सकते हैं कि ऐसा क्यों हो रहा है ?

यह स्पष्ट है कि आलेख रेखा की आकृति उसमें निरूपित राशियों के बीच संबंध पर आधारित है। यही संबंध रेखा की आकृति को निर्धारित करता है। अब हम उन राशियों के बीच संबंध ढूँढ़ते हैं।

आलेख क्रमांक 1 में,


$$X_1 = 1, X_2 = 2, X_3 = 3, X_4 = 4, X_5 = 5$$

$$Y_1 = 25, Y_2 = 50, Y_3 = 75, Y_4 = 100, Y_5 = 125$$

$$\text{यहाँ, } \frac{Y_2 - Y_1}{X_2 - X_1} = \frac{50 - 25}{2 - 1} = \frac{25}{1}$$

$$\frac{Y_3 - Y_2}{X_3 - X_2} = \frac{75 - 50}{3 - 2} = \frac{25}{1}$$

$$\frac{Y_5 - Y_4}{X_5 - X_4} = \frac{125 - 100}{5 - 4} = \frac{25}{1}$$



आलेख-01

આલેખ ક્રમાંક 4 મેં,

$$\frac{Y_2 - Y_1}{X_2 - X_1} = \frac{3 - 3.5}{2 - 1} = -0.5$$

$$\frac{Y_3 - Y_2}{X_3 - X_2} = \frac{2.5 - 3.0}{3 - 2} = -0.5 \quad \dots\dots\dots \text{ઇત્યાદિ}$$

આલેખ ક્રમાંક 5 મેં,

$$\frac{Y_2 - Y_1}{X_2 - X_1} = \frac{8 - 4}{2 - 1} = 4$$

$$\frac{Y_3 - Y_2}{X_3 - X_2} = \frac{12 - 8}{3 - 2} = 4 \quad \dots\dots\dots \text{ઇત્યાદિ}$$

હમ દેખ રહે હું કે આલેખ 1, 4, 5 મેં સે પ્રત્યેક મેં

$$\frac{Y_2 - Y_1}{X_2 - X_1} = \frac{Y_3 - Y_2}{X_3 - X_2} = \dots\dots\dots \text{નિયત હું ઔર}$$

ઇનકે આલેખ ભી સરલ રેખા હું।

યાને જહાં ભી આલેખ મેં


$$\frac{Y_2 - Y_1}{X_2 - X_1} = \frac{Y_3 - Y_2}{X_3 - X_2} = \frac{Y_4 - Y_3}{X_4 - X_3} = \dots\dots\dots = \frac{Y_n - Y_{n-1}}{X_n - X_{n-1}} = \text{નિયત હોંગે}, \quad \text{આલેખ-05}$$

વહું આલેખ સરલ રેખા કે રૂપ મેં હોગા। ઇસ પ્રકાર કે આલેખોં મેં રાશિયોં કે બીજ કે સંબંધ કો રૈખિક સમીકરણ $ax + by = c$ યા $y = mx + c$ કે રૂપ મેં દર્શા સકતે હું।



ક્યા આલેખોં મેં ભી ઇસ પ્રકાર કા કોઈ સંબંધ હૈ?

આલેખ ક્રમાંક-7 મેં હમ દેખતે હું કે-

$$\frac{Y_2 - Y_1}{X_2 - X_1} = \frac{25 - 23}{7 - 6} = \frac{2}{1}$$



આલેખ-04



આલેખ-07

$$\frac{Y_3 - Y_2}{X_3 - X_2} = \frac{27.5 - 25}{8 - 7} = \frac{2.5}{1}$$

$$\frac{Y_4 - Y_3}{X_4 - X_3} = \frac{29 - 27.5}{9 - 8} = \frac{1.5}{1}$$

इत्यादि ।

स्पष्ट है कि

$$\frac{Y_2 - Y_1}{X_2 - X_1} \neq \frac{Y_3 - Y_2}{X_3 - X_2} \neq \frac{Y_4 - Y_3}{X_4 - X_3} \dots \dots \dots$$

इसी प्रकार का संबंध आप आलेख क्रमांक 6 में भी देख सकते हैं।

इन दोनों उदाहरणों में

$$\frac{Y_2 - Y_1}{X_2 - X_1}, \frac{Y_3 - Y_2}{X_3 - X_2}, \frac{Y_4 - Y_3}{X_4 - X_3} \dots \dots \dots \text{नियत नहीं हैं।}$$

इसलिए इन उदाहरणों में आलेख सरल रेखा नहीं है।


करके देखें

अपने विद्यालय के बगीचे के कुछ पौधों की लंबाई को 10 सप्ताह तक कापी में नोट कीजिए और प्राप्त अँकड़ों से आलेख खींचकर यह देखिए कि पौधों की लंबाई में किस प्रकार से परिवर्तन हुए हैं?

विभिन्न परिस्थितियों में बने आलेख को पढ़ना

अब हम विभिन्न उदाहरणों की सहायता से आलेख को पढ़ना, समझना और उसका विश्लेषण करना सीखेंगे।

उदाहरण-1. दो गमलों A और B में दो अलग अलग प्रकार के पौधे लगाए गए हैं जिनकी ऊँचाइयाँ 5 सप्ताह तक हर सप्ताह के अंत में मापी गईं। इन मापों को नीचे आलेख में दर्शाया गया है। आलेख की सहायता से निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए —



- પાઁચવેં સપ્તાહ કે અંત મેં દોનોં ગમલોં કે પૌધોં કી ઊંચાઈ બતાઇએ।
- કૌન સે સપ્તાહ મેં ગમલે A કે પૌધે કી ઊંચાઈ મેં સબસે અધિક બઢોતરી હુઈ ઔર કિતની?
- ચૌથે સપ્તાહ કે અંત મેં ગમલે B કે પૌધે કી ઊંચાઈ કિતની થી?

હલ:- આલેખ મેં હસ દેખ પાતે હું કિ –

- પાઁચવેં સપ્તાહ કે અંત મેં ગમલે A કે પૌધે કી ઊંચાઈ 12 સેમી. ઔર ગમલે B કે પૌધે કી ઊંચાઈ 10 સેમી. થી।
- દૂસરે સપ્તાહ મેં ગમલે A કે પૌધે કી ઊંચાઈ મેં 3 સેમી. કી બઢોતરી હુઈ। યહ બાદ કે કિસી અન્ય સપ્તાહ મેં હુઈ બઢોતરી સે જ્યાદા થી।
- ચૌથે સપ્તાહ કે અંત મેં ગમલે B કે પૌધે કી ઊંચાઈ 8 સેમી. થી।


ઉદાહરણ-2. એક 20–20 ક્રિકેટ મૈચ કે દૌરાન દો ટીમોં A ઔર B કે દ્વારા બનાએ ગએ રનોં કો નિમ્નાંકિત આલેખ મેં પ્રદર્શિત કિયા ગયા હૈ –

આલેખ કી સહાયતા સે નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉત્તર દેખિએ –

- ટીમ A ને 16 ઓવર તક કિતને રન બનાએ?
- કિસ અંતરાલ કે દૌરાન ટીમ A ઔર ટીમ B કે રન બનાને કી દર સબસે અધિક થી?
- કિસ અંતરાલ કે દૌરાન ટીમ A ઔર ટીમ B કે રન બનાને કી દર સબસે કમ થી?
- 8 વેં ઓવર કે પશ્ચાત ટીમ A ઔર B કે રનોં મેં કિતના અંતર થા?
- આલેખ કો દેખકર બતાઇએ કૌન સી ટીમ વિજયી હુઈ।

હલ:-

- ટીમ A ને 16 ઓવર મેં 126 રન બનાએ।
- 16 સે 20 ઓવર કે અંતરાલ મેં ટીમ A ઔર ટીમ B કે રન બનાને કી દર સબસે અધિક થી।
- 4 સે 8 ઓવર કે અંતરાલ મેં ટીમ A કે રન બનાને કી દર સબસે કમ થી તથા ટીમ B કે રન બનાને કી દર 8 સે 12 ઓવર કે અંતરાલ મેં સબસે કમ થી।
- 8 વેં ઓવર કે પશ્ચાત ટીમ A ઔર B કે દ્વારા બનાએ ગએ રનોં મેં 6 રન કા અંતર થા।
- આલેખ સે સ્પષ્ટ હૈ કિ ઇસ મૈચ મેં ટીમ B વિજયી હુઈ।




આલેખ-10

करके देखें


आप भी अपने मित्रों के साथ खेले गए क्रिकेट मैच में बनाए गए रनों को आलेख पर दर्शाइए।

प्रश्नावली 1

1. *u�psfn, x, nksv ky ſk ad ksnsfk j cr kb, fd D; kav ky ſk (A) सरल रेखा तथा आलेख (B) वक्र रेखा के रूप में हैं?*



आलेख-(A)



आलेख-(B)



- (i) आलेख (A) से क्या निष्कर्ष निकाले जा सकते हैं?
(ii) यह निष्कर्ष आलेख (B) से प्राप्त निष्कर्ष से किस तरह अलग है?
2. एक व्यक्ति ने अपनी गाड़ी में 5 लीटर पेट्रोल भरवाया। पाँच दिनों में बचे हुए पेट्रोल की मात्रा व दिनों को निम्नांकित सारणी में दर्शाया गया है –

दिन	1	2	3	4	5
बचे हुए पेट्रोल की मात्रा (ली. में)	4	3	2	1	0

बचे हुए पेट्रोल की मात्रा व दिनों के मध्य आलेख खींचिए।

3. मूलधन 300 रुपये पर 5 प्रतिशत वार्षिक ब्याज दर से 1, 2, 3, 4 व 5 वर्ष के लिए साधारण ब्याज निम्न सारणी में प्रदर्शित है।

સમય (વર્ષ મેં)	0	1	2	3	4	5
સાધારણ બ્યાજ (રૂપયે મેં)	0	15	30	45	60	75

સમય વ સાધારણ બ્યાજ કે બીચ આલેખ ખીંચિએ।

4. x કે વિભિન્ન માનોનું કે લિએ x^2 કા માન જ્ઞાત કરકે x ઔર x^2 કે માનોનું કે બીચ એક આલેખ ખીંચિએ। x કા માન -4 સે $+4$ પૂર્ણાંક સંખ્યાએँ હૈનું।
5. એક પરિવાર મેં 5 સપ્તાહ તક ઉપયોગ કિએ ગાએ પ્યાજ કી માત્રા કિગ્રા. મેં નિમ્ન સારણી મેં દી ગર્દી હૈ—

સપ્તાહ	1	2	3	4	5
પ્યાજ કી માત્રા (કિગ્રા. મેં)	1	2	3	4	5

સપ્તાહ એવં ઉપયોગ કિએ ગાએ પ્યાજ કી માત્રા કે બીચ આલેખ ખીંચિએ।


6. એક વિજ્ઞાન પત્રિકા મેં છપે લેખ કે અનુસાર કિસી સ્થાન વિશેષ પર રહને વાલી ચીંટિયોની ચાલ પર તાપમાન કા પ્રભાવ પડ્યતા હૈ। યદિ કિસી સ્થાન પર રહને વાલી ચીંટિયોની ચાલ વ ઉસ સ્થાન કે તાપ કે બીચ કે સંબંધ કો સમીકરણ $s = \frac{t - 20}{5}$ સે પ્રદર્શિત કિયા ગયા હો જહાઁ t તાપ ($^{\circ}\text{C}$) મેં વ s ચાલ (સેમી. પ્રતિ સેકણ્ડ) હૈ। તબ ચીંટિયોની ચાલ $t = 25^{\circ}, 30, 35^{\circ}, 40$ રખતે હુએ તાપમાન વ ચાલ મેં દર્શાને વાલે સંબંધ કો આલેખ મેં પ્રદર્શિત કીજિએ તથા નિમ્ન પ્રશ્નોનું કે ઉત્તર દીજિએ—
 1. x અક્ષ પર કૌન સા ઓંકડા ચુના।
 2. y અક્ષ પર કૌન સા ઓંકડા ચુના।
 3. x અક્ષ ઔર y અક્ષ પર ઓંકડે દર્શાને કે લિએ આપને ક્યા પૈમાના ચુના?
 4. જહાઁ ચીંટિયોની ચાલ 2.5 સેમી. પ્રતિ સેકણ્ડ હૈ ઉસ સ્થાન કા તાપમાન ક્યા હૈ?
 5. યદિ તાપમાન 30°C સે 40°C હો જાએ તો ચીંટિયોની ચાલ મેં કિતના પરિવર્તન હોગા ?

7. અનીતા ને અલગ-અલગ લંબાઈયોની પાઇપ સે વાદ્ય યંત્ર બનાએ હૈનું। પાઇપ કી લંબાઈ (સેમી.) વ ધ્વનિ કા સ્વર માન (Pitch) (ચક્ર પ્રતિ સેકણ્ડ) કે બીચ ગણિતીય સંબંધ કો નિમ્નાંકિત સારણી વ આલેખ મેં પ્રદર્શિત કિયા ગયા હૈ—

ધ્વનિ કા સ્વર માન (ચક્ર પ્રતિ સેકણ્ડ મેં)	64	128	192	261	300	395	438	512
પાઇપ કી લંબાઈ (સેમી.મેં)	80	41	26	19	18	13	12	10

आलेख को देखकर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए –

- (i) 160 चक्र प्रति सेकण्ड के लिए पाइप की लंबाई कितनी रखानी चाहिए ?
(ii) 60 सेमी. लंबी पाइप का स्वरमान कितना होगा ?



8. नीचे A और B दो सारणियाँ दी गई हैं उनमें प्रदर्शित राशियों के मध्य आलेख खींचिए और जाँचिए कि क्या उनमें $\frac{Y_2 - Y_1}{X_2 - X_1}$ नियत है ?

सारणी A

	X_1	X_2	X_3	X_4	X_5
वृत्त की त्रिज्या r (सेमी. में)	2	4	6	8	10
वृत्त की परिधि $2\pi r$ (सेमी.में)	4π	8π	12π	16π	20π

$Y_1 \quad Y_2 \quad Y_3 \quad Y_4 \quad Y_5$

सारणी B


	X_1	X_2	X_3	X_4	X_5
वृत्त की त्रिज्या r (सेमी. में)	1	2	3	4	5
वृत्त का क्षेत्रफल $A = \pi r^2$ (वर्ग सेमी. में)	π	4π	9π	16π	25π

$Y_1 \quad Y_2 \quad Y_3 \quad Y_4 \quad Y_5$

- 9 किसी शहर में एक दिन में दर्ज तापमान के ऑकड़े ग्राफ द्वारा दर्शाए गए हैं।

दिए गए ग्राफ के आधार पर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए—


- सुबह 6 बजे शहर का तापमान कितना था?
- दोपहर बाद 3 बजे का तापमान कितना था?
- किस समय दिन का तापमान 30 डिग्री था?
- आधी रात 12 बजे तापमान कितना रहा होगा?
- रात 9 बजे तापमान कितना रहा होगा?



- 10 एक शहर में किसी पूरे दिन वायु के प्रदूषण का स्तर नापा गया।

इसे ग्राफ द्वारा प्रदर्शित किया गया है—दिए हुए ग्राफ द्वारा निम्नलिखित सवालों के जवाब खोजिए।

- सुबह 8 बजे प्रदूषण का स्तर कितना पाया गया?
- प्रदूषण स्तर सबसे अधिक किस समय दर्ज किया गया?
- दोपहर बाद 4 बजे प्रदूषण का स्तर कितना था?
- दोपहर 12 बजे से शाम 6 बजे तक प्रदूषण में कितना अन्तर आया?
- रात 1 बजे से सुबह 4 बजे तक प्रदूषण में कितनी गिरावट आई?



हमने सीखा

1. आलेख के माध्यम से किन्हीं दो राशियों के बीच के संबंध को देखना।
2. दिए गए ऑँकड़ों से आलेख बनाना। इसके लिए कौन सी राशि किस अक्ष पर रहेगी यह चुनना। अक्ष पर पैमाना कैसे समझेंगे और चुनेंगे।
3. विभिन्न परिस्थितियों में बने आलेखों को पढ़ना।
4. आलेख में दी गई जानकारी से निष्कर्ष निकालना।

